

રાજકોટ રૂરલ જિલ્લા :- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- એપ્રિલ/૨૦૧૯

- (૧) તા.૧૭/૦૪/૨૦૧૯ ના રોજ એલ.સી.બી.નો સ્ટાફ જેતપુર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રહે મળેલ હકિકત આધારે જેતપુર નેશનલ હાઇવે ધારેશ્વર ચોકડી પાસેથી (૧) કરણભાઈ સ/ઓફ અશોકભાઈ મગનભાઈ પરમાર જાતે ટે.પુ ઉ.વ. ૨૦ રહે ગોંડલ ભગવતપરા ત્રીનબતી ચોક સામે મેલડી માના મંદિર પાસે નદીના ખાડામા (૨) મહેન્દ્ર ઉર્ફે બાલો સ/ઓફ વશરામભાઈ પોલાભાઈ સરવૈયા જાતે ખાંટ ઉ.વ. ૨૧ રહે ગોંડલ ભગવતપરા સુખનાથ નગર મણીમંદિર બાજુ માં વાળાઓને (૧) સોના ના ચેઇન નંગ-૩ તથા અલગ અલગ ડીઝાઇન ના સોના ના ચેઇન-૩ ના કટકાઓ જેની કુલ કી.રૂ.૧,૯૪,૦૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦,૦૦૦/- (૩) એક્ટીવા 5G મો.સા.કી.રૂ.૪૦,૦૦૦/- ના મુદામાઇ સાથે પકડી પાડી નીચે મુજબના પાંચ વણશોધાયેલ ગુન્હે શોધી કાઢી મુદામાલ તથા આરોપીને જેતપુર સીટી પો.સ્ટે.માં સોંપી આપેલ છે.
- (૧) જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૦/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯,૩૫૬,૧૧૪
(૨) જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૬/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯,૩૫૬,૧૧૪
(૩) જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૭/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯,૩૫૬,૧૧૪
(૪) ઉપલેટા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૩/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯,૩૫૬,૧૧૪
(૫) ઉપલેટા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૪/૧૯ ઇ.પી.કો.ક. ૩૭૯,૩૫૬,૧૧૪
- (૨) આ કામના આરોપીઓએ પોતાના હાવાલા વાળી કારમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય ઘટકો વાળો માદક પદાર્થનો જથ્થો વજન ૨ કીલો ૫૨૦ ગ્રામ કિમત રૂ. ૧૭,૬૪૦/- ના મુદામાલ સાથે મળી આવતા ગોંડલ તાલુકા સે.ગુ.ર.નં. ૪૭/૧૯ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૧(બી) મુજબનો ગુન્હે નોંધાયેલ છે. જે અન્વયે આ કામના આરોપીઓ નં.(૧) અસરક્રમાઇ ઉર્ફે અચુ હબીબભાઈ ધાંચી ઉવ.૪૪ રહે. સુભાષનગર, રાજકોટ (૨) હૈદરઅલી આબેદહુશેન બુખારી ઉવ. ૫૨ રહે. બરકાતી પરા, ગોંડલ (૩) હાર્દિકભાઈ મહેન્દ્રભાઈ મકવાણા વાણંદ ઉવ.૧૯ હે.કોઠીકંપાઉન્ડ, રાજકોટ વાળાઓને પકડી આ કામે વનસ્પતિજન્ય ગાંઝાના ઘટકો વાળો માદક પદાર્થનો જથ્થો ૨ કીલો ૫૨૦ ગ્રામ કિ. રૂ. ૧૭,૬૪૦/- તથા સ્વીફ્ટ ડીઝાયર કાર નં. જીજે-૩ સીએ ૯૫૭૨ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નં. ૩ કિ. રૂ. ૬૦૦૦/- નો મુદામાલ રીકવર કરેલ છે.
- (૩) જેતપુર સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૩૨/૨૦૧૯ ઇ.પી.કો.ક.૩૯૭, ૩૪૧, ૪૫૦, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ ના કામે ફરીયાદી રેવાનંદ ગુરૂશ્રી અખડાનંદ સરસ્વતી સાધુ ઉ.વ.૬૨ રહે.જેતપુર નવાગઢ, બળદેવધાર પાંચપીપળા જવાના માર્ગ પર સતીવાવ આશ્રમ વાળા પોતાના આશ્રમમાં સુતા હતા ત્યારે આરોપીઓએ આશ્રમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદી સુતા હતા તે રૂમની બારીની ગ્રીલ તોડી તેના વાટે અંદર પ્રવેશ કરી ફરીયાદીને લોખંડની રાપ તેમજ લાકડીઓ તથા ઢીકાપાટ્ટનો માર મારી ઇજા કરી રોકડ રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ ની લુંટ કરી ફરીયાદીને રૂમમાં બહારથી દરવાજો બંધ કરી નાશી જઇ ગુન્હે કરતા બનાવ બનેલ છે. આ વણશોધાયેલ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ (૧) દિનેશભાઈ નરસીંહભાઈ ડામોર જાતે.આદીવાસી ઉ.વ.૨૨ (૨) રામસીંગભાઈ મોતીયાભાઈ ડામોર જાતે.આદીવાસી ઉ.વ.૨૧ (૩) જોનીભાઈ તેરસીંગભાઈ ડામોર જાતે.આદીવાસી ઉ.વ.૨૩ (૪) સુકરમભાઈ નવલસિંહ ડામોર ઉ.વ. ૨૨ રહે.બધા.કાણાકુવા તા.ધાનપુર જી.દાહોદ વાળને તા.૨૪/૪/૧૯૮ ના ક.૨૨/૩૦ વાગ્યે અટક કરી રોકડા રૂ.૧૫,૦૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ રૂ.૩૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગુન્હે ડીટેક્ટ કરેલ છે.